

WIL/SEC/2023

Bombay Stock Exchange Limited	National Stock Exchange of India Limited
Department of Corporate Services,	ListingCompliance Department
SP. J. Towers, Dalal Street,	Exchange Plaza, Bandra-Kurla Complex,
Mumbai - 400 001	Bandra (E), Mumbai – 400 051
(Scrip Code-514162)	(Symbol: WELSPUNIND)

Dear Sirs/ Madam,

Subject: Newspaper Advertisement

In accordance with the Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith a copy of the newspaper publications with respect to Unaudited Financial Results for the quarter ended December 31, 2022 published on January 31, 2023 in Financial Express (English), Kutchmitra and Kutchuday (Gujarati).

Please take the above information on record.

Thank you,

For Welspun India Limited

Shashikant Thorat Company Secretary ICSI Membership No. : FCS-6505

Welspun India Limited

Welspun House, 6th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013, India. T : +91 22 6613 6000 / 2490 8000 F : +91 22 2490 8020 / 2490 8021 E-mail : companysecretary_wil@welspun.com Website : www.welspunindia.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370 110, India. T : +91 2836 661 111 F : +91 2836 279 010

Works: Survey No. 76, Village Morai, Vapi, District Valsad, Gujarat 396 191, India. T : +91 260 2437437 F: +91 260 22437088

Corporate Identity Number: L17110GJ1985PLC033271

TUESDAY, JANUARY 31, 2023

Gujarat Informatics Limited

NOTICE INVITING BIDS

15

g Directo

FINANCIAL EXPRESS SUMEDHA Sumedha Fiscal Services Limited CIN: L70101WB1989PLC047465 CIN: IC70101WB1989PLC047465 Regd. Office: 6A, Geetanjali, 8B Middleton Street, Kolkata - 700 071 Telephone Nos.: 033-2229-8936 / 6758 2: investors@sumedhafiscal.com Website: www.sumedhafi Email ID: investigations that is a second where the investigation of 0.55 emails mail ID: investors@ NOTICE OF POSTAL BALLOT wering werit up retrieves for this Postal ballot. The Notice along with the explanatory statement is available or the website of the Company i.e. www.sumedhafiscal.com, website of remote e-volting service provider Central Depository Services (India) Limited ("CDSL") and on the website of BSE Limited, i.e. www.bselndla.com www.bseindia.com The Company has completed dispatch of Postal Ballot Notice through e-mail on Monday, January 30, 2023 to the members and the second second second second second second second beneared and the Calculation of the second second second na accordance with the MCA Circulars, the Company has made necessary arrangements for the members to register their e-mail address. Members who have not registered their e-mail address are requested to register the same. address. Members with have not registered their 6-mail address are address. Members would be able to coast the values and convery their assant (FOR) or dissent (AGAINST) to the proposed resolution only through the remote e-voltag process. Members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on the Cu-Of Dals will only be considered eighble for the purpose of e-voltag-treat this notice for information purpose only. The detailed procedure / instructions on the process of remote e-voltag including the manner in which the Members who have not yet registered their email addresses can register than email address and or cast their volte, are specified in the Notice. Shareholding values that he in proposition to his/heritis and elastronic shareholding in failit, shall be company. Date: January 31, 2023 Place: Mumbai

nanenoding) shall be in proportion to his/heirits shareholding in the paid-up equity share capital of the Company. Remote e-voting facility shall commence on Wednesday, 01st february 2023 (9:00 AM, 157) and end on Thursday, considered that no reply has been received from the Members, The remote e-voting module shall be disabled threatest by CSL. Once the vote on a resolution is cast by a member, no change will be allowed subsequently. Considered that no reply has been received from the Members, The remote e-voting module shall be disabled threatest by CSL. Once the vote on a resolution is cast by a member, no change will be allowed subsequently. Company Sacratay, as Soruinizer for conducting the Postal Ballot process in a fair and transparent manner. The Scrutinizer's decision on the validity of the Postal Ballot shall be final. The results along with Scrutinizers Report shall be declared on or before Friday, 3rd March 2023 by placing the same on the velocity communicated to the Stock Exchanges is LaBES 4 CSL, and Cantel Depository Services (India) Limited. Any grievance commetci with the Postal Ballot may be addressed to the Company at Investors@sumedhafiscal.com or the mploid@github.com. For any queries or issuer regarding e-voling, your may refer the Frequently Akade Questions (FAQ) and e-voling manual available at www. evolution/gitad.com under help section or write an email to helpdek, evolutg@colinida.com. 10.

t www.evotingindia.com under help section o elpdesk.evoting@cdslindia.com. For SUMEDHA FISCAL SERVICES LIMITED Sd/-

Place : Kolkata Date : 30th January, 2023

ABANS[®] **ABANS HOLDINGS LIMITED** (Formerly known as Abans Holding Milce: 36, 37, 38A, Floor 3, Narimar in Point, Mumbai 400 021 | Phone ww.abansholdings.com: Email Id: sy n Bhavan, Backbay Reclam No.: +91-022-61790000 Narimai Website: ow

NOTICE OF POSTAL BALLOT

NUTLE UP PUSINE BALLUI Mambers are hereby informed hat pursues to the provision of Section 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as an ended (the 1447), next the Management Andrey S. Internal Exciton 100, no. 142020 dated and 15, 2020, 122020 dated April 13, 2000, 202/200 dated May 5, 2020, 222020 dated April 5, 2020, 122020 dated April 13, 2000, 202/200 dated May 5, 2020, 222020 dated April 5, 2020, 222020 dated April 13, 2000, 202/200 dated May 5, 2022, 122020 dated April 5, 2020, 122020 dated April 13, 2000, 202/200 dated May 5, 2022, 123020 dated April 5, 2020, 122020 dated April 14, 2000, 202/200 dated May 5, 2022, dated May 6, 2022, dated May 7, 2022, dated May 6, 2022, dated May 6, 2022, dated May 6, 2022, dated May 6, 2022, dated May 7, 2022, dated May 6, 2022, dated May 7, 2022, dated M rs are hereby in

Internate a source uner unpravery is sought for the following special resolution by way memory execution of special resolution and the source of the source

e snæremoter of the Company as on the Cul-off Dale shall freid the Postal Baliel Nofoie (e information purposes odiv). The Company has engaged the services of National Securities Depository Limits (NSCI) for the purpose of providing e-varing facility to all is Members. The remote e-value shall commerce on Thursday, February 2. 2023 at 900 a.m. (IST) and end on Friday, Marc 2. 2023 at 500 p.m. The e-voltip facility to all is desiabed by Nich Internation.

shall commerce on Thursday, Horvary 2. 2023 # 9.0 Bar. (KST) and end on Friday, March 2. 2023 # 50.0 m. The e-working facility will be disable by 16:01. Unrelative. Marnhers who have net updated their = mail address are requested for register the same in respect to share here by them in electricity for the same in separation participant and in respect of shares held in physical form by writing to Company rs support share and on the spect of shares held in physical form by writing to Company rs support share and on the spect of shares held in physical form by writing to Company rs support share and the respect of shares held in physical form by writing to Company rs support shares and the respect of shares held in physical form by writing to Company rs support shares and the respect of the shares held in physical form by writing to Company rs support shares and the respect to the time. By the Packeting Company Secretary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer of Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a the scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Memrichee) Rummer 2016 ja a scrutinizer (Scrutitizer) for conducting the e-volting facetary (Scrutitizer) for conducting the e

au case, or any queries or privances pertaining to e-voting, shareholders are requested to con-fis. Despain Dhar, Purva Staregolary (India) Pvt. Lid. Limit to, S. Sho Shad Industratificat georgeoing and the start of the start georgeoing start of the start georgeoing start of the star

For Abans Holdings Limi (Formerly known as Abans Holdings Private Limit Sheela Gu

7.65

6.789.53

619.38 392.13

Dipali Goenka (CEO and Jt. MD) DIN: 00007199

Quarter Ended Year Ended 31.12.2022 31.12.2021 31.03.2022 (Unaudited) (Unaudited) (Audited)

1.618.21


FOR AND ON BEHALF OF THE BOARI

81.71 56.05

1.419.94

419.94 79.18 51.98 51.91

The Indian Wood Products Company Ltd. Regd. Off. 7th Floor, 9 Brabourne Road. Regd. Off. 7th Floor, 9 Brabourne Road, Kolkata - 700 001 CIN - L20101/WB1919PLC003557 Tel: 8222023820, Fax: 033 22426799 Website: www.iwpkatha.com; E-mail: iwpho@lwpkatha.co.in E-mail: hepho@hepatina.co.m NOTICE is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday. February 07, 2023, at 5.0 PM at 16B, Judges Court Road, Kolkata – 700 027. West Bengal. To consider and approve. Inter alia, the Un-Audited Financial Results of the Invest, Rumate – 100 027, West Bengal "To consider and approve, inter alia, the Un-Audited Financial Results of the Company for the Quarter and Nine Months anded December 31, 2022".



'MPORTANT'

whiles care is taken phone acceptance or adventising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be hidd responsible for sur-pressite of ransactions with companies, associations o individual adventising in its newspapers or Publications We therefore recommend that readers make necessary inquiries before sending any monies o entering into any agreements with adventisers o otherwise acting on an adventisement in any manne g into any agreements with advertisers o se acting on an advertisement in any manne otherwise ac whatsoever.

GIL invites Bid through GeM portal route for Supply, Installation, Commissioning & Maintenance of Firewall Appliances on behalf of Directorate of Technical Education, Gandhinagar. For more details visit to: **https:/gil.gujarat.gov.in** & GeM portal - Managing

LIVE the MOVIE

INOX LEISURE LIMITED Registered Office: 5[®] Floor, Viraj Towers, Next to Andheri Flyover, Western Express Highway,Andheri (East), Mumbai – 400093, India Te: (91 22) 4066 5000 [Email: contact@inoxmovies.com | Website: <u>www.inoxmovies.com</u> | CIN: L92199MH1999PLC353754

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31" DECEMBER, 2022

GiL

				(< in Lakhs
Sr.	Particulars	Quarter Ended	Nine Months Ended	Quarter Ended
No.		31-12-2022	31-12-2022	31-12-2021
1	Total Income from operations	51,557	1,47,195	29,647
2	Net Profit/(loss) for the period before tax (Before exceptional Items)	2,862	5,158	(160)
3	Net Profit/(loss) for the period before tax (After exceptional Items)	424	2,720	(160)
4	Net Loss for the Period after tax (After exceptional Items)	(4,041)	(2,369)	(132)
5	Total Comprehensive Income for the period (Comprising loss for the period after tax and Other Comprehensive Income after tax)	(4,041)	(2,380)	(111)
6	Paid-up equity share capital (face value ₹10 per share)	12,234	12,234	12,219
7	Earnings/(loss) per share (face value of ₹10/- each)			
	a) Basic (₹)	(3.31) *	(1.94) *	(0.11) *
	h) Diluted (2)	(3.31) *	(1 04) *	(0.11) *

(*) Not annualized Notes:

The above results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors at its meeting held on 30° January, 2023. The Statutory auditors of the Company have carried out audit of the above results and have issued unmodified

on 30°January, 2023. The Statutory auditors of the Company have carried out audit of the above results and have issued unmodified audit report. 2. The above results are an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements). Regulations, 2015. The full format of the audited quarterly standalone and consolidated Financial Results are available on the Stock Exchanges' website (www.bseindia.com) and on the Company swebsite (www.inoxmovies.com). 3. Information on Standalone Financial Results: (% in Lakha) 3. Information on Standalone Financial Results: (% in Lakha)

Sr.	Particulars	Quarter Ended	Nine Months Ended	Quarter Ended
No.		31-12-2022	31-12-2022	31-12-2021
1	Total income from operations	51,557	1,47,195	29,647
2	Net Profit/(loss) for the Period before tax (After exceptional Items)	421	2,723	(159)
3	Net Loss for the Period after tax (After exceptional Items)	(4,042)	(2,364)	(131)

Siddharth Jair

Director

Place : Mumbai Date : 30° January, 2023



IIFL Finance Limited CIN: L67100MH1995PLC093797 Registered Office: IIFL House, Sun Infotech Park, Road No. 16V, Plot No. B-23, Thane Industrial Area, Wagle Estate, Thane – 400604 Te: (91-22) 4103 5000 • Fax: (91-22) 2580 6654 • E-mail: <u>shareholders@iifl.com</u>

Website: www.iifl.com

		Quarter Ended		Nine Mor	iths Ended	Year Ended
Particulars	Dec 31, 2022 (Unaudited)	Sept 30, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Dec 31, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Mar 31, 2022 (Audited)
Total Revenue from Operations	2,120.95	2,026.31	1,798.12	6,078.03	4,980.16	6,837.40
Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	555.15	529.44	394.30	1,518.50	1,116.37	1,535.98
Net Profit / (Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary Items)	555.15	529.44	394.30	1,518.50	1,116.37	1,535.98
Net Profit / (Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary Items)	423.21	397.07	309.88	1,150.00	867.30	1,188.25
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (After tax) and Other Comprehensive Income (After tax)]	424.72	421.82	320.10	1,178.20	859.26	1,197.46
Paid up Equity Share Capital	75.99	75.95	75.86	75.99	75.86	75.92
Reserves (Excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						6,387.91
Securities Premium Account	3,418.48	3,415.43	1,848.16	3,418.48	1,848.16	1,845.85
Net worth	8,571.04	8,171.50	6,088.61	8,571.04	6,088.61	6,273.85
Paid up Debt Capital/ Outstanding Debt	36,001.39	35,531.27	33,670.55	36,001.39	33,670.55	35,725.15
Debt Equity Ratio	3.63	3.75	5.38	3.63	5.38	5.52
Earnings Per Share (Face Value of ₹2/- each) (for continuing and discontinued operations)						
- Basic	9.96	9.99	8.17	28.64	22.87	31.33
- Diluted	9.90	9.94	8.12	28.45	22.73	31.14
Capital Redemption Reserve	230.11	230.11	230.11	230.11	230.11	230.11
Debenture Redemption Reserve	12.80	12.80	12.80	12.80	12.80	12.80
Debt Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
Interest Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.

Vex a first characteristic instantiant results of control paper of intercontract characteristic instantiants principles generally accepted in India an excerdised under Section 133 of the Companies Act, 2013 et al with relevant fluids framed thereunder and other accounting principles generally accepted in India an excerdised under section 2014 of the SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, as amended. The above maudi instantiants (frame) accepted in India an installated financial results for the guarter and nine months needed December 31, 2022, have been reviewed by the Audit Committee and approved by the Board at its mee eld on January 30, 2023. The Joint Statutory Auditors of the Company have carried out the Limited Review of the Advectant results and have issued an unmodified erg Disclosure Requirements and results of the Company have carried out the Limited Review of the Advectant Review of the Advectant results and have issued an unmodified erg

		Quarter Ended		Nine Mon	ths Ended	Year Ended
Particulars	Dec 31, 2022 (Unaudited)	Sept 30, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Dec 31, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Mar 31, 2022 (Audited)
Total Revenue from Operations	984.85	1,039.68	1,168.61	2,988.00	3,007.45	4,062.31
Profit/ (Loss) Before Tax	212.46	292.87	299.94	715.70	683.44	967.37
Profit/ (Loss) After Tax	159.03	220.47	226.32	536.38	514.79	745.48
Total Comprehensive Income/(Loss)	156.55	245.88	227.36	553.39	496.37	735.63

4. The Board of Directors of the Company has declined an inferim dividend of 44, per equity share of the face value of 27, each for the flancal war 2022-32. While Heaving V3D as the Record Director and the flancal Research and the flancal Research and the flancal Research and Research a

By order of th For IIFL Finance Limited

Date : January 30, 2023 Place : Mumbai

R Venkataraman Joint Managing Director DIN: 00011919





	Lower Parel, Mumbai, Maharashtra - 400013. E-mail : co	mpanysecretary	_wil@welspu	un.com
	EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOL FOR THE QUARTER AND NINE MONTHS END			TS
-		0		(₹ in Crores
Sr.		Quarte	r Ended	Year Ende
No.	Particulars	31.12.2022 (Unaudited)	31.12.2021 (Unaudited)	31.03.2022 (Audited)
1	Total Income	1,904.05	2,437.92	9,377.31
2	Profit before Tax	78.54	167.07	872.97
3	Net Profit for the period	43.83	131.06	606.71
4	Total Comprehensive Income/(loss) for the period [Comprising profit for the period (after tax) and Other			
	Comprehensive Income (after tax)]	63.64	143.02	590,85
5 6	Equity Share Capital (Shares of Re. 1 each) Other Equity as shown in the Audited Balance Sheet	98.81	98.81	98.81
	as on March 31,2022			3.872.87
7	Security Premium Accounts as shown in the Audited			
	Balance Sheet as on March 31,2022			123.81
8	Net Worth	3,735.75	3,864.97	3,766.29
9	Paid up Debt Capital/ Outstanding Debt	100.00	125.00	125.00

5	Equity Share Capital (Shares of Re. 1 each)	98,81	98.81	98.8
6	Other Equity as shown in the Audited Balance Sheet			
	as on March 31,2022			3,872,8
7	Security Premium Accounts as shown in the Audited			
	Balance Sheet as on March 31,2022			123.8
8	Net Worth	3,735.75	3,864.97	3,766.2
9	Paid up Debt Capital/ Outstanding Debt	100.00	125.00	125.0
10	Outstanding Redeemable Preference Shares	-		
11	Debt Equity Ratio (in times)	0.71	0.81	0.7
12	Earnings Per Share (of Re. 1 each) (Not annualised for quarters)			
	a) Basic	0.43	1.34	6.0
	b) Diluted	0.43	1.34	6.0
13	Capital Redemption Reserve as shown in the Audited			
	Balance Sheet as on March 31,2022			162.4
14	Debenture Redemption Reserve as shown in the Audited			
	Balance Sheet as on March 31,2022			
15	Debt Service Coverage Ratio (in times)	2.40	4.10	4.1
16	Interest Service Coverage Ratio (in times)	3.19	9.03	7.6
			. <u> </u>	

16 Interest service Uverage runne (a market)
1 The above is an extract detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under
Regulation of 33 of the SEBI (Listing Obligations and Other Disclosure Requirements) Regulation 2015. The
lift format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites www.heistindia.com
and www.bseindia.com and also on company's website www.webspunindia.com,
2 Additional Information on standalone financial results is as follow:
({ In crores;
}

Particulars

1 Total Income 2 Profit before Tax 3 Net Profit for the period 4 Total Comprehensive Income for the period(after tax)

Mumbai Date : January 30, 2023

financialers.epar.in

Corporate Identity Number - L17110GJ1985PLC033271) Regd. Office: Welspun City, Village Versamedi, Tatkka Anjar, Dist, Kutch, Gujarat - 370110 Corp. Office: Welspun House, Bih Floor, Karnala Mills Compound, Senapati Bapat Marg.

Contemporation of the sended December 31, 2022. The said Notice may be accessed on the Company's Website at http://www.ivpkatha.com and may also be accessed on the Stock Exchange website at https://www.bseindia.com For The Indian Wood Products Co. Ltd. Sd. Piace: Kolkata Anup Gupta Date: 30 January 2023 Company Secretary



અંજાર : અંગ્રેજી માધ્યમની શાળાની

દીવાલના નબળા કામ મુદ્દે રાવ

જાગૃત નાગરિકે

સમક્ષ કરી રજૂઆત

સંબંધિતો



ત્યારે આવી કંપનીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ લઇ તેમની જમીનનું મામૂલીના બદલે યોગ્ય

સ્થાનિકોને રોજગારી મળે તેવી

વળતર આપે તેમજ જમીન વેચનાર પરિવારની બે વ્યક્તિને કાયમી નોકરી આપવાનો કરાર

કરવા તેમજ સૂચિત પ્રોજેક્ટ સ્થાપનારી કંપનીએ સીએસઆર કંડમાંથી પૂરતી રકમ કાળવી શિક્ષણ, આરોગ્ય સહિતની

પણ તા. પંચાયતના પૂર્વ પ્રમુખની મુખ્યમંત્રીને રેજૂઆત

ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર આપે

ભુજ, તા. ૩૦ : સરહદી લખપત તાલુકામાં આગામી સમયમાં નવા ઉદ્યોગોનું આગમન થાય તેવી હિલચાલ તેજ બની છે ત્યારે આ ઉદ્યોગ ક્લ્મે

થીય તાવા હહવાલ તારુ ગમા છ ત્યારે આ ઉદ્યોગ જૂથો દ્વારા સ્થાનિકોને મહત્તમ રોજગારી અને ખેડૂતોને તેમની જમીનનું પૂરતું વળતર મળે તેવા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના કામો હાથ ધરે તેવી રાજ્યના મુખ્યમંત્રી પાગે ગજગાન દગાલ છે

લખપત તાલુકા પંચાયતના માજી પ્રમુખ પી. સી. ગઢવીએ

કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર જીએમડીસી ત્રણ નવી ખાણ તેમજ જીએમડીસી અને

પાસે રજઆત કરાઇ છે

પેપર ફૂટ્યું એથી વધુ આઘાતજનક બેરોજગારીનો આંક

દર વખતે પરીક્ષામાં પેપર ફૂટી જાય....!એ કેટલી બેદરકારી કહેવાય...!મોટી બેદરકારી તો એ

છે કે, ભાજપ સરકાર રોજગારીની

ગમે તેટલી વાતો કરે પણ ૧૧૮૧ ગગા માટે ૯,૫૦,૦૦૦ અરજીઓ આવે તે દુર્ભાગ્ય છે. કેટલી બેકારી છે....!

પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાય એ ફૂટી કેમ જાય...! આમાં ચોક્કસ ગગ છે અને ગેંગ મધ્ય ગુજરાત,

ઉત્તર ગુજરાતની છે. થણા તલાટીઓની ભરતીમાં લખપત તાલુકામાં આવ્યા છે,

પરંતુ 'માંગણા પત્રક' કોને ક્રહેવાય, કેમલખાય, 'ઠરાવ બંધ' કેમ લખાય એ ખબર નથી

સામાન્ય નોલેજ પણ નથી. ત્યારે

તાનાશાહી ઢબે શાસન ચલાવી

૧૧૮૧ જગ્યા માટે ૯,૫૦,૦૦૦ નોકરીવાંચ્છુઓની અરજીથી સરકારના રોજગારીના દાવા પોકળ

દયાપર (તા. લખપત), તા ૩૦ : સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ પોતાના ભવિષ્યની રાહ જોતાં હોય અને વારંવાર અંજાર અંગ્રેજી માધ્યમની શાળાની આક્ષેપિત દીવાલ તસવીરમાં નજરે પડે છે. 'પેપર ફૂટી ગયું' સમાચાર સાંભળે ત્યારે કેવી વેદના થાય તે બેરોજગારને જ ખબર પડે.

પાણીનું વહેણા હોવાથી અહીં ઊભેલી દીવાલના પાયા નભળા પડી ગયા છે. તેમ છતાં અહીં નવેસ ટ દીવાલ બનાવવાની જગ્યાએ જૂની દીવાલ ઉપર ચયાતર કરવામાં આવી રહ્યું હોવાના આલોપાં કાચ્યા છે. આ પ્રાથમિક શાળામાં છથી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ પ્રશરે નભળી ગાવવાના સાથેના પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષામાં ૧૧૮૧ જગ્યા માટે સાડા નવ લાખ અરજીઓ આવી હતી અને સરકારે ૨૯/૧ના પરીક્ષા જાણ કરી હતી, પરંતુ મોટા ભાગના પરીક્ષાર્થીઓ પરીક્ષાના સ્થળ પર પહોંચી ગયા પછી્ ખબર પડી કે 'પેપર ફૂટી ગયું' જાણો સાડા નવ લાખ જાણા સાંગ્ર પંચ લાખ પરીક્ષાર્થીઓનું ભાગ્ય ફૂટી ગયું. છેક છેવાડા લખપત તાલુકાના બેરોજગારો ગાંધીધામ, આદિપુર અને મધ્ય ગુજરાત સુધી પરીક્ષા આપવા ગયા હતા. વહેલી આપવા ગયા હતા. વહેલી સવારના ૯.૩૦ કલાકે પરીક્ષા સવારના ૯.૩૦ કલાકે પરીક્ષ સેન્ટર પર પહોંચી જવાની સૂચના હોતાં દૂરના પરીક્ષાર્થીઓને આગલા દિવસે નીકળવું પડે અને સવારના મુસાકરીમાં હોય ત્યારે કોઈ ન્યૂઝ ચેનલ ન જુએ, એ તો ચાલુ ભરમાં પણ વાંચવામાં શમગુલ, જયારે વાયા વાયા ખબર પડી કે, પેપર ફૂટી જતાં પરીક્ષા રક જા છે. ત્યારે દરન્ટગી આવતા પડો ક, પપર રૂડા જતા વસલા અ થઈ છે, ત્યારે દૂરદૂરથી આવતા પરીક્ષાર્થીઓને ધ્રાસકો પડ્યો હતો....! વળી શું થયું...! આટલી બધી વાંચવાની મહેતન કર્યા પછી

છેવાડાના નોકરી ઈચ્છુકો જ્યારે આદિપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પહોંચ્યા ત્યારે બહાર લાગેલી નોટિસ વાંચવા મળી જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર : વિશ્વનાથ જોષી)

લાગે છે કે, આ 'પેપર ફૂટ્યા' ના કારસ્તાન વર્ષોથી ચાલુ છે. જેની ખબર હવે પડે છે અને કચ્છના બેરોજગારો સજા ભોગવે છે આજે પેપર ફૂટ્યા પછી સરકારે પરીક્ષાથીઓને સેન્ટરથી રીટર્ન જવા એસ.ટી. ભાડું પક્ત હતું. પણ ગુજે નગરી ભાસ માટે કોઈ પરિપગ ન હોતાં વિદ્યાર્થીઓને ટિકિટ આપવી પડી. આ બેદરકારીનાં પણ બેદરકારી કેટલી બેકારી છે...! વર્ષ ૨૦૧૪માં રેવન્પૂ તલાટી અને ચીક ઓ સિરન્પા પરીક્ષા પેપર ફૂટી ગયા, વર્ષ ૨૦૧૫માં તલાટીનું પેપર ફૂટ્યુ... ૨૦૧૧ પ્રમાં તલાટીનું પેપર ફૂટ્યુ... પેપર ફૂટ્યુ... પેપર ફૂટ્યુ... પેપર ફૂટ્યુ... આ સ્ટાકાર સિસ્ટમ બદલાવતી છેન્ની ગા પેગમાં પેપર લ્લાય અં આ બેદરકારીમાં પણ બેદરકારી આ ભેદરકારામાં પણ ભેદરકારા છે. બેરોજગારોને હવે વિશ્વાસ નથી રહ્યો. કંઈ મોટું આંદોલન થાય છે. યુવાનો સડક પર આવે તે પહેલાં સરકારે સિસ્ટમમાં કેરકાર કરવાં જરૂરી છે.પેપર ફૂટી જ જાય છે. ૧૧ પકડાયા ઘરપકડ થાય...! તાત્કાલિક પગલાં ભરાશે… ! આ પરિણામથી બેરોજગારને પારણામથા બરાજગારન પરીક્ષાર્થીઓને શું ફાયદો… ? કેટલીવાર પકડાય છે તોય 'પેપર ફૂટ્યા'ના સિલસિલા યથાવત્ છે. હેકીકતમાં સરકારના અમૂક ચોક્કસ પદાધિકારીઓ કે અધિકારીઓની રહેમ નજર વગર અમૂક આ બધું અશક્ય છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ અને હિન્દુસ્થાન નિર્માણ દળ દ્વારા બનાવને વખોડાયો

શાસન દરમ્યાન અનેક વખત પેપરો ફૂટ્યા, સાથે બેરોજગાર યુવાનોના નસીબ પણ ફૂટ્યા હોવાનું જણાવી ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરી h.d.

Local news paper Gandhidham/Mundra adevertisement Bulk Hiring in Bipin Group (Fresher and exp.) 1. Data entry operator 2. Container surveyor 3. Deck/Wharf checker 4. Casual Labour Interview time

from 10 am to 6 pm Date - 30 January to 03 Feb 23 Mob. 9687654326/29/334

98.8

(CEC



ભટકેલી મહિલાને વન સ્ટોપ સેન્ટરનો આશરો… મુંદરા ખાતે આવી ચડેલી અને બે દિવસથી એસ.ટી. બસ સ્ટેશનમાં બેઠેલી મહિલાને પોલીસ અને સેવાભાવી સંસ્થાનાં માધ્યમથી ભુજ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો હતો. આ મહિલા કાંઇ બોલતાં ન હોવાથી તેમનું નામ કે સરનામું જાણી શકાયાં ન હતાં. મહિલા બાબતે જયેશ ગોરે જનસેવા સંસ્થાના રાજ સંઘવીને જાણ કરતાં તેમણે પોલીસ ઇન્સ્પેકટર હાર્દિક ત્રિવેદી અને વન્ સ્ટોપ સેન્ટરને વાકેક કરતાં ખુશ્ભુબેન પટેલ અને અંજલિબેને આવીને કબ્જો સંભાળ્યો હતો. જનસવા સંસ્થા હારા ભાંજન અને ધાવળાની વ્યવસ્થા કરાઇ હતી. ડેપો મેનેજર વિશાલગર ગુંસાઇ તથા પોલીસ ૧૦૦ મોબાઇલના જગદિરાસિંહ અને પીનાબેન મદદરૂપ બન્યાં હતાં.



આવા અમારા માલવલા ગ્રાહકાલ પાંદા કરવાના કે, લાશન ૭૧/૦૨/૨૦૨૩ અને બુધવારના રોજ અગત્થનું સમારકામ હોવાથી નીચે શાવેલ ગ્રામ્ય, શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોને સવારના ૦૯:૦૦ પાગ્ચાથી સાંગ/ભપોરના ૧૧ : ૦૦ વાગ્ચા સુધી વિષપુરવઠો મળશે નહીં. વિસ્તાર : ૬૬ કે.વી. કંડલા સ/સમાંથી નીકળતા તમામ ૧૧ કે.વી. ફીડરો ઉપરોક્ત આઉદેજ દરચ્યાન બંધ રહેશે.

નિર્ધારીત કામ વહેલું પૂરું થતાં બીજી કોઈ પણ જાતની જાહેરાત વાચ પુન : વીજપુરવઠો સ્થાપિત કરવામાં આવશે. તેની નોંધ લેવા વિનંતી કાર્ચપાલક ઈજનેર (પ્રવહન),

૨૨૦ કે.વી. સબ સ્ટેશન, ગેટકો, અંજાર



ભારત ટાચર્સ ગુજરાત પ્રા.લિ.

BTGPL ()

ારત ટાચર્સ ગુજરાત પ્રા.લિ. અને CEATગાંધીધામમાં સૌથી મોટા ટ્રક સર્વિસ સેન્ટર સાથે આવી રહ્યું છે. ભારત ટાચર ુ કિસ્ટ્રીબ્યુટર તથા બિઝનેશ પાર્ટનર છે.

વર્કશોપ સંબંધિત કુશળ મિકેનિક જોઈએ છે.

- ટક અને કાર (Alignment &
- Balancing Experts) : ୦૫ નંબર મશીન ઓપરેટર/સુપરવાઈઝર
- (ટાચર રીટેડિંગ-રીમોલ્ડીંગ) : ૦૫ નંબર વર્કશોપ ટેકનિશિચન : ૦૫ નંબર
- 🔸 ટાચર ક્રિટર : ૦૪ નંબર
- 🛥 ટાચર કેસીંગ એક્સપર્ટ : ૦૨ નંબર

+

રસ ધરાવતા ઉમેદવારોએ ૦૨/૦૨/૨૦૨૩ના રોજ અથવા તે પહેલા વહેલામાં વહેલી તકે અરજીઓ CV (BIO-DATA) અ સંદેશ મોકલવાના રહેશે. +91 9998406500



વકરી છે. બહારના લોકો

આવકારવા આતુર હોવાનુ જાણવા મળે છે. કચ્છના ડુંગરાળ વિસ્તારમાં તથા રશ સંત્રમાં પીવાનાં પાણીના ફાંફા પડે છે અને વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે. તેવામાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરીને માંડ માંડ માત્ર કઠોળ પકવતા હોય ત્યારે સરકારની યોજના

ફરિયાદ અને જુબાની વચ્ચે વિરોધાભાસ થકી પાંચ વર્ષ જૂનો છેડતીનો કેસ રદ

ભુજ, તા. ૩૦ : પાંચેક વર્ષ પૂર્વે ભુજની સહજીવન ટ્રસ્ટ નામની સંસ્થામાં સાથે નોકરી કરતી યુવતીએ સાથી કર્મચારી વિટ્રેટ બેડળી



કેસની વિગતો મુજબ ૨૦૧૭માં ભોગ બનનાર અને ભાવેશ ૨૪નીકાંત સોની

ભાવેશ ૨૪નીકાંત સોની સહજીવન સંસ્થામાં સાથે નોકરી

સહજીપન સસ્યાના સાથ નાકરા કરતા હતા અને ભોગ બનનારે ભાવેશે અભદ્ર ટિપ્પણી કરીને નોકરીના સ્થળે છેડતી કરી

હોવાની ભાવેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ

કરી

અરજી દાખલ કરતાં આ કેસ રદ (કવાસ) કરવા હુકમ કર્યો છે. આરોપી ભાવેશ તરફ ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, જિજ્ઞેશ એમ. નાયક તથા સ્થાનિકે ચિન્મય આચાર્ય, જિગરદાન ગઢવી અને રોહિત મહેશ્વરી હાજર રહી દલીલો કરી હતી.

પ્રકારે નબળી ગુણવત્તા સાથેના કામને કારણે ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. આ મામલે યોગ્ય તપાસ માધ્યમની નવી ઈમારતના બાંધકામમાં અત્રે આવેલી જૂની જર્જરીત દીવાલ ઉપર બ્લોક નાખીને તેની ઉંચાઈ વધારવામાં કરી ગુણવત્તાયુક્ત બાંધકામ તે માટે તેમણે માંગ કરી હતી. આવી રહી છે. આ સ્થળે વરસાદી

minal .

તંત્રને પણ આ કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કચ્છમાં ઉદ્યાગા આવતા પરપ્રાંતીયોની વસ્તી ખૂબ વધી ગઈ છે. આ પરપ્રાંતીયો પૈકી પરપ્રાંતીયોની વધુ વસ્તીવાળા વિસ્તારોમાં પોલીસ

કેટલાક ગુનાહિત માનસિક્તા ધરાવતા હોય છે. તાલુકાના શેખપીર ચોકડી, કુકમા, પરપ્રાંતીયોને આડેધડ શેખપીર ચોકડી, કુંકમા, મિયાણીપટ્ટીના ગામડાઓ તથા આસપાસના ક્ષેત્રમાં આ સમસ્યા ભાડે અપાતાં મકાનોને લઈને પણ સમસ્યા

મકાનભાડે રાખ્યા બાદ ઘણી વખત ગુના આચરી નાસી જાય છે, જેને લઈને આ વિસ્તારમાં ભય તંત્ર સથન કાર્યવાહી કે, તે આવશ્યક છે. થોડો સમય પહેલાં મુંદરા પંચક્રમાંથી શાર્પશૂટર પુકડાયા પછી પોલીસે કુડક પગલાં ઉ, ભો થયો છે. આ વધતી જતી ગેરપ્રવૃત્તિઓ ઉપર તત્કાળ અંકુશની માંગ ઊઠી છે. લીધા હતા, પરંતુ આવી કામગીરી બીજે ક્યાંય ન કરાઈ. પરિણામે આવી પરપ્રાંતીય શ્રમિકોની વસાહત ધરાવતા વિસ્તારોમાં જાણકારોના કહેવા મુજબ વધુ ભાડાની લાલ્ચમાં મકાન્ ભાડે આપનારાઓથી માંડીને યેસાહત વરાવાતા વસતારાવા ગેરપ્રવૃત્તિ દિવસાદિવસ વધી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. કુકમા, શેખપીર, ગડા પાટિયા વગેરે ગેરપ્રવૃત્તિ કરતા પરપ્રાંતીય વિરુદ્ધ કડક હાથે કામ લેવું જરૂરી છે. અનેક ગુનાઓના સંશોધનમાં પોલીસ

પચ્છમ સુજલામ સુફલામ યોજનાને આવકારવા આતુર

વર્ષ ૨૦૧૮થી ગુજરાત સરકારે સુજલામ સુફલામ થકી નર્મદાનાં પાણીથી ડેમો ભરવાનું

રાર કલુ છે. સાથે સાથે ચોમાસાં પહેલાં તળાવો ઉંડા ઉતારવાની કામગીરી પણ થઈ રહી છે. ઘણી સંસ્થાઓ પણ થઇ રહ્ય છે. પણા સસ્યાઓ આ કાર્યમાં જોડાઈ છે. તળાવો, ડેમોનાં પાશી ખેતરો સુધી પહોંચાઊને ખેડૂતો ચોમાસું પાક તૈયાર કરતા થયા છે. આવા સમયે કેટલાક માહિતી તૈયાર કરતા થૈયા છે. આવા સમયે કેટલાક માહિતી અધિકારના કાર્યકારો દ્વારા માહિતી માગવાના બહાને કરાતા કનડગતનો આ વિસ્તારના ઘણી મદદરૂપ થઈ શકે તેવું આ

ફોજદારી કેસ જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલતા ભોગ્ બનનારની જુબાની અને નોંધાવેલી ફરિયાદમાં તદ્દન



AME FROM LILATA (IJAYASINA to LILAVA (IJAYSINH ASHER FOR PRACTICAL PURPOSE DBJECTION TOWARDS NAME CHANGE MAY PLEAS NAME CHANGE TO EMB/

પેપર લીક એ વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે વિશ્વાસઘાત સમાન ભુજ, તા. ૩૦ : હાલમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પૈપર લીક થતાં અને પ્રીક્ષા મોકૂફ

લુડિયા પાસે કાર-ટ્રક અથડાતા ત્રણ ઘાયલ

સાય ગંડાનાતા કરતા ફાર્પાઝા અબ્દુલ તેમજ મોહમદ તથા અમર અલીઅસગર સૈયદને ઈજા પહોંચતા ૧૦૮ મારફત્ ભુજની



પહોંચતા ૧૦૮ નારસ્ત ભુજપા જી.કે. જનરલ હોસ્પિટલમાં અકસ્માત સર્જ ટ્રકચાલકટ્ટક મૂકી નાસી ગયો હતા. ફરિયાદી અબ્દુલને અસ્થિભંગ તથા અન્યોને સામાન્ય ઈજા CHANGE OF NAME

MUNICATE TO EME F IN DIA, MUSC PLOMATIC QUARTER IUWAIR, P. BOX NO. ISTAL CODE 112, R LTANATE OF OMAN.

પરીક્ષાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે. આ પેપર લીકના કૌભાંડીઓ સામે સરકારે તથા ભાજપના મુખ્યમંત્રીએ કોઇ જ નક્કર કાર્યવાહી કે તકેદારી રાખી નથી.

તાનાશાહા ઢળ શાસન ચલાવા સત્યને દબાવી રહી છે. જેની સામે પ્રજાએ સંગઠિત સ્વરૂપે બહાર આવી અહિંસક રીતે લડત ચલાવી બોધપાઠ ભણાવવો જોઈએ. નહિતર ગુજરાતની રહેતાં ૧૦ લાખ જેટલા શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય-વિશ્વાસઘાત્ થયેલ શિક્ષણ વ્યવસ્થા ખતમ થઇ જશે. આ બનાવ પછી ખરેખર શિક્ષણમંત્રીએ નૈતિકતાના ધોરણે સરકારની અક્ષમ્ય બેદરકારીની ઘટનાને વખોડાઇ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવા પેપર લીકના બનાવોથી વાલીઓ-વિદ્યાર્થીઓ તથા રાજીનામું આપી દેવું જોઇએ એવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાઇ હતી. વાલાઆ-ાવઘાયાઓ તથા રાજ્યની પ્રજામાં આક્રોશ છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૨ જેટલા પેપરો લીક થવાથી นว์โลเ

કરાઇ હતી. તો, હિન્દુસ્થાન નિર્માણ દલ-કચ્છ ઢારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પાઠવેલા પત્રમાં જશાવ્યું હતું કે, ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ગઇકાલે ફૂટી ગયું, જેને લઇ પરીક્ષા મોફક રખાઇ. મોકૂફ રખાઇ. જેટલા

પરાયાં પાકૂર ૨૧૧૭. ૯,૫૪,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની મહેતન પર પાણી કરી ગયું. ભાજપના ૨૫ વર્ષના હાલમાં ભાજપ સરકાર WELSPUN INDIA WELSPUN INDIA LIMITED Regd. Office: Wels

EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOLID FOR THE QUARTER AND NINE MONTHS ENDER DATED FINANCIAL RESULTS D DECEMBER 31, 2022 Year Ende 31.03.202 31.12.2022 31.12.2021 Particulars 2,437.9 78.54 872.97 167.07 63.64 98.81 43.02 98.81

	3.872.8			as on March 31,2022
lited				Security Premium Accounts as shown in the Audited
15	123.8			Balance Sheet as on March 31,2022
3,735,75 3,864,97 3,76	3.766.2	3.864.97	3,735,75	Net Worth
100.00 125.00 12	125.0	125.00	100.00	Paid up Debt Capital/ Outstanding Debt
			-	Outstanding Redeemable Preference Shares
0.71 0.81	0.7	0.81	0.71	Debt Equity Ratio (in times)
ed for guarters)				Earnings Per Share (of Re. 1 each) (Not annualised for guarters
0.43 1.34	6.0	1.34	0.43	a) Basic
0.43 1.34	6.0	1.34	0.43	b) Diluted
dited				Capital Redemption Reserve as shown in the Audited
16	162.4			Balance Sheet as on March 31,2022
Audited				Debenture Redemption Reserve as shown in the Audited
2 (400) 012224 V				Balance Sheet as on March 31,2022
	4.1	4 10	2.40	Debt Service Coverage Ratio (in times)
2.40 4.10				
3.19 9.03 Ity Financial Results filed with the Stock Exchanges in d Other Disclosure Requirements) Regulation 2015	7.6 anges unde n 2015. Th	9.03 e Stock Excha its) Regulation	ults filed with ure Requirem	Interest Service Coverage Ratio (in times) es : he above is an extract of detailed format of Quarterly Financial Re egulation of 33 of the SEBI (Listing Obligations and Other Disclo
3.19 9.03 ty Financial Results filed with the Stock Exchanges d Other Disclosure Requirements) Regulation 2019 lable on the Stock Exchange websites www.nseindia site www.webspunindia.com.	7.6 anges unde n 2015. Th	9.03 e Stock Excha ts) Regulation bsites www.ns	ults filed with ure Requirem ck Exchange	Interest Service Coverage Ratio (in times) es : he above is an extract of detailed format of Quarterly Financial Re
3.19 9.03 ty Financial Results filed with the Stock Exchanges d Other Diaclosure Requirements) Regulation 2015 liable on the Stock Exchange websites www.resendd site www.webpulnindia.com. ts is as follow: (t in Co	7.6 anges unde n 2015. Th seindia.com	9.03 e Stock Excha tts) Regulation bsites www.ns (1	ults filed with ure Requirem ck Exchange unindia.com.	Interest Service Coverage Ratio (in times) es : he above is an extract of detailed format of Quarterly Financial Re tegulation of 33 of the SEBI (Listing Obligations and Other Discio 1) format of the Quarterly Financial Results are available on the SI nd www.bseindia.com and also on company's website www.web dditional Information on standalone financial results is as follow:
3.19 9.03 hy Financial Results field with the Stock Exchanges at 00 Dec Diaclosce Requirements Regulation 2015 Itable on the Stock Exchange websites www.resends environment and the Stock Exchange websites www.resends the www.respinindia.com. ts is a follow: (f in Cri Quarter Ended 31.12.2022 31.12.2021 31.03.2013	7.6 anges unde n 2015. Th seindia.cor ₹ in Crorer	9.03 a Stock Excha tts) Regulation bsites www.ns (1 ad Yi .12.2021 3	ults filed with ure Requirem k Exchange unindia.com. Quarter Er 1.12.2022	Interest Service Coverage Ratio (in times) es: The above is an extract of detailed format of Quarterly Financial Regulation of 33 of the SEBI (Listing Objaptions and Other Diado all format of the Quarterly Financial Results are available on the SU ditional Information on standalone financial results is as follow: Particulars
13.19 9.03 ty Financial Results filed with the Stock Exchanges of Other Disclosure Requirements, Regulation 2015 fiable on the Stock Exchange websites www.nesingli- tiable on the Stock Exchange website (Unauties) (Unauties) (Unauties) (Avail 13.03.2 (Unauties) (Unauties) (Unauties) (Avail 13.03.2 (Unauties) (Unauties) (Unauties) (Unauties) (Avail 13.03.2 (Unauties) (Unauties) (Una	7.6 n 2015. Th seindia.col र in Crore fear Ender 31.03.2022	9.03 e Stock Excha its) Regulation bisites www.ns (1 ed Yi .12.2021 3 audited) (ults filed with ure Requirem ck Exchange v unindia.com. Quarter Er 1.12.2022 saudited) (fi	Interest Service Coverage Ratio (in times) es: The above is an extract of detailed format of Quarterly Financial Regulation of 33 of the SEBI (Listing Objaptions and Other Diado all format of the Quarterly Financial Results are available on the SU ditional Information on standalone financial results is as follow: Particulars
3.19 9.03 hy Financial Results field with the Stock Exchanges at 00 Dec Diaclosce Requirements Regulation 2015 lable on the Stock Exchange websites www.nseindia sets www.rspinindia.com. Regulation 2016 (in Comparison 2016) Quarter Ended Var Et 31.12.2021 (Unaudited) 13.12.2021 (Unaudited) 1,14.19.94 1,15.2.11 6,76	7.6 n 2015. Th seindia.cor ₹ in Crorer fear Ender 31.03.2022 (Audited)	9.03 e Stock Excha ts) Regulation bsites www.ns (1 ed Yi 12.2021 3 audited) (1,618.21	Quarter Er (12.2022) audited) (1 1,419.94	Interest Service Coverage Ratio (in times) es : ho above is an extract of detailed format of Quarterly Financial Re logulation of 33 of the SEB (Listing Okigations and Other Discio I format of the Quarterly Financial Results are available on the SB nd www.bseindia.com and alao on company's website www.web didtional Information on stalato and the company's website set of the set of the SB Particulars ()
3.19 9.03 ty Financial Results filed with the Stock Exchanges of Other Disclosure Requirements, Regulation 2015 fiable on the Stock Exchange websites www.neelinguinfindi.com. Stock St	7.6 anges unde n 2015. Th seindia.com t in Croren (ear Ender 31.03.2022 (Audited) 6,789.53	9.03 e Stock Excha its) Regulation beites www.ns (1 ed Yi 1,2.2021 3 audited) (1,618.21 81.71	ults filed with ure Requirem ck Exchange i unindia.com. Quarter Er 1.12.2022 (1 audited) (1 1.419.94 79.18	Interest Service Coverage Ratio (in times) es: The above is an extract of detailed format of Quarterly Financial Regulation of 30 of the SEBI (Listing Objaptions and Other Disclo due for and www.skeinda com and tablo or company's website www.web dditional Information on standalone financial results is as follow: Particulars Total Income Total Income

ate : January 30, 2023



ટ્રકના અકસ્માતમાં ત્રણ ઘાયલ થતાં સારવાર હેઠળ ખસે ડયા છે. આ અકસ્માત અંગે ખાવડા પોલીસ મથકે ભુજના અન્દુલ મજીદ મામદ નોડેએ લખાવેલી કરિયાદ મુજબ ગઈકાલે સાંજે રિવક્ટ કાર નં. જે જે.- વં. જે જે.-ડીએસ-૦૯૬૪માં બેઠા હતા અને ગાડી મોહમદ અમીન હસ્ત ચલાવી ગક્ષા હતા. ત્યારે લીચા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે

... બ બહાને કરાતા કનડગતનો આ વિસ્તારના ખેડૂતો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભુજ, તા. ૩૦ ઃ ખાવડા ધોરીમાર્ગ પર ગઈકાલે કાર અને

ગુનાહિત માનસ ધરાવતા લોકો પોતાનો મતલબ સરી જાય એટલે નાસી જાય છે. ગાસા જાવ છે. આવા સંજોગોને લઈને જાગૃત લોકોમાં ચિંતા પ્રસરી છે. પોલીસે આ વિસ્તારમાં સઘન તપાસ કરવી જોઈએ અને મકાન તપાસ કરવા જાઈઅ અન મકાન માલિકો મકાન ભાડે દેવા સંદર્ભે જાહેરનામા મુજબની કાર્યવાહી કરે તે સુનિશ્વિત કરવું આવશ્યક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કરાને લોકો જતા રહે છે. વડેશા કિસ્સામાં મકાન માલિકને ભાઉં પણ નસીભ થતું નથી. આવા લોકો શું કળા કરી ગયા તે જાણી શકાતું નથી. રોજગારીની આડમાં કેટલાંક

જતી ગેરપ્રવૃત્તિ ઉપર તત્કાળ રોક જરૂરી

વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારનાં આવેલાં વિવય ઉદ્યોગોને પગલે છેલ્લા થોડા સમયથી પ્રપ્રાંતીય વસ્તીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જિલ્લા

વધારા જાવા મળ્યા છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા છતાં મકાન ભાડે આપતી વખતે કાળજી રખાતી નથી અને પોલીસને પણ જાણ કરાતી નથી. ઘણી વખત બે ચાર મહિનામાં જ મકાન ખાલી કરીને લોકો જતા રહે છે. ઘણા

SZEI LIED

dl. 39-09-२०२3

ભુજમાં રૂપારેલ-સોમૈયા પરિવાર આયોજિત ભાગવત કથાની પૂર્ણાહુતિ કચ્છી જગડુશા સ્વ. દામજીભાઈ એન્કરવાલાને કચ્છમાં અપાઈ અંજલી



6

મહાવીર પશુ રક્ષ કેન્દ્ર, મુન્દ્રા આર.ડી. એજ્યુકેશન સહિતની સંસ્થાઓ અને આગેવાનો શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા

માં માર્ગ્ય માર્ગ્ય સુધ ગુ ગ, 3 પ્ર ગ પાડા. પર 32 પા સહિતની સંસ્થાઓ અને આગેવાનાં પ્રક્ષાસ્થન અપણ કર્યા મુન્દ્રા કરા કરાર ના સર દામજીભાઈ વિધિ સંસ્થાઓમાં અનેક પર પર સેવા બજવી છે. અછત હોય કે દુષ્કાળ, શાળાના પ્રશ્નો હોય કે આરોગ્યના તેઓ હેમેશા સેવા માટે તત્પર રહેતા હતા. પ્રાગ્યર રોડ પર આવેલા મુંગ્યા થુપ્ય થીની સારસંથાળા ગાયવા ભગવાન મહાવીર પશુ રશે કેન્દ્રમાં સેવા આપતા રહ્યા. ક્લ્રાબ્યાં ગયે તે તકલીક હોય સા લેવક ઉધોગપરીત સિપાની પર વા પ્રયાળ શ્ર વગર મહાવીર પશુ રશે કેન્દ્રમાં સેવા આપતા રહ્યા. કલ્યુઓ ગયે તે તકલીક હોય સા લેવક ઉધોગપરીત સિપાની પર વા હાય વા ગયાન મહાવીર પશુ રશે કેન્દ્રમાં સેવા આપતા રહ્યા. કલ્યુઓ ગયે તે તકલીક હોય સા લેવક ઉધોગપરીત સિપાની પર વા હાય વા વગ વા આપી સંવેડ છે. મુન્દ્રા આર. ડી. એજપુ માં ટ્રસ્ટી પટે સેવા આપતા થવે. દામજીભાઈ એન્ટરવાલાના માનમાં ગઈકાલે તમામ આરોધી શાળાઓ ર મિનિટનો માં ન પાયા હાઢાજીલ આપતિ કરી હતી અને આધી જ્ય જાહેર કરી હતી તેલું આરડી ટ્રસ્ટના પ્રમુખ વિશ્વાપછી અટવી, તે પા, ના ક્લિયો દ્વારા વાળાઈ આહેર, ન પાના કારોબારી ચરમેન ડાયાલાલભાઈ આહેરા, પ્રણવ થયેથી, શક્તિસિંહ જોડજા, જિલ્લા ભાજપના વાલજી ટાપરિયા, છળાયોન ગઢવી, વિજયસિંહ જાડેજા, માં જા આરી, સર્વ સેવા સંધના જીગરભાઈ અટવી, જ્યા સાભાળી કુવારી, સ્વર પ્રણ વરોપારી, પ્રમુખ વંધીકાળેન પાટીદાર, ભુપેન મહેતા, શહેર સ્વરાભાને જોયી, લિપ્યમુખ ચંદીકાળેન પાટીદાર, ભુપેન મહેતા, શહેર પ્રયુખ કરા મહેતા વગેરે દુ:ખ સાક તરા કર્યો હતો.

છે. સ્વ.દામજીભાઈએ કંડારેલી સેવા અને પરોપકારની કેડી પર પરિજનો આગળ વધતા રહે અને દામજીભાઈના સેવા યજ્ઞને અખંડ પ્રજવલીત રાખે તેવું ઉમેર્યું હતું.

. કચ્છની જાણીતી સ્વૈચ્છીક સંસ્થાઓ કવીઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તારચંદભાઈ છેડાએ જીગર તારવદભાઇ છડાએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દિલેર સખી દાતા દામજીભાઈની ચિર વિદાયથી ક્ચ્છી પ્રજાએ પોતાનાં છેડા સાથે મળીને દામજીભાઈએ જીવદયા, આરોગ્ય, શિક્ષણ અને માનવસેવા માટે સંદાય સેવાની

નર્મદાના સિંચાઈ જળની હંમેશા

આ ઉપરાંત અનેકવિધ શૈક્ષણીક કાર્યો, જળ સંગ્રહના કાર્યો માટે તેમનું ઉદાર યોગદાન રહ્યું હતું.દામજીભાઈના દુઃખદ નિષેનથી કચ્છે જગડુશાં . જેવા ાનયનથા કચ્છ જગણશા જવા દિલેર દાતા ગુમાવ્યા છે. સર્વ સેવા સંઘ અને કવીઓ જૈન મહાજન બન્ને સંસ્થાઓએ પોતાનું પ્રેરકબળ ગુમાવ્યું છે. ભુજના પૂર્વ નગરપતિ ધારાશાસી શંકરભાઈ સચદેઓ

પારાપ્રાભા શકરનાઇ સપરબ્ધ અંજલિ આપતા જણાવ્યું હતું કે, દામજીભાઈની રાહબરી હેઠળ મુંબઈમાં યોજાયેલી વિશાળ જનકૂચના કારણે જ કચ્છના નર્મદાનો પ્રશ્ન ઉકેલાયો હતો. એ ્પૈતિહાસિક ઘટના કચ્છના લોકોને હંમેશા યાદ રહેશે. કચ્છ માટે તેમણે બહુમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી કચ્છે એક સાચો હ્વદર્દ્ ગુમાવ્યો છે. કચ્છના દાનવીર શેઠ જગડ્શાના કચ્છના દાનવીર શઠ જગડુશાના નામથી પ્રચલિત એવા શાહ દામજીભાઈ એન્કડરવાલાનું અચાનક નિધન થતા કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્રી, દીગમુઠ છે એવા સખાવતી દાતાનું અવસાન થવાથી અમો પણ શોક્રમઅ ભીએ આવી અમો પણ ગોક્રમઅ છીએ આવી આત્માને શાંતિ મળે એવી રોયલ ફાઉન્ડેશન તરફથી તેઓનો કાર્યને કચ્છ પ્રજા યાદ તેઓના કાયન કચ્છે પ્રજા યોદ રાખશે. શબ્દોથી અંજલિ આપી હતી. અનવર જુમા નોડે, હરીસિંહ જોડેજા, તેજસ થત્રિય, કાસમ સમેજા, હમીદ નોડે, રાજેન્દ્ર શેઠ, અકીલ નોડે, સત્ત્ર અમીરશા સૈયદ વગેરે અંજલી આપી હતી.

31.03.2022

872.9

590.85 98.81

3.872.8

123.81 3,766.29 125.00

0.78

6.06 6.06

162.43



ગાંધીધામ

જયંતિલાલ

મહેશભાઈ

ુ જયંતિલાલ પ્રવિણભાઇ

મોહનભાઈ

મોહનભાઈ

અધ્યક્ષ,

ધર્મેશ

મેહુલ નરેશ યશેષ

હર્ષ શ્રેય

જિલ્લા ભાજપ

પરિવારે શ્રદ્ધાસુમન

પાઠવ્યા ઃ સર્વ સેવા સંઘ અને કવીઓ જૈન મહાજન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ

શિરમોર ઉદ્યોગપતિ

અને જૈન શિરોમણી એવા પ્રખર દાતા દામજીભાઈ લાલજીભાઈ

ઓકરવાલાનું અવસાન થતા સમગ્ર કચ્છ સહિત ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે ત્યારે

કચ્છ જિલ્લા ભાજપ પરિવારે સ્વ.દામજીભાઈને હ્રદયપૂર્વક

સંદેશ પાઠવતા કચ્છ જિલ્લા

સદરા પાઠપતા ૩૨૨૭ ાઝલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દામજીભાઈના કોઠે અને હોઠે સદેવ કચ્છ અને

કચ્છીયતની જ વાત રહેતી હતી. જૈન ધર્મના સેવા, અહિંસા અને

શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. આ દુઃખદ અવસરે

પરિવારના રશ્મિકાંત ખટાઉભાઈ પરિવારના શેઠિયા, ઠક્કર, શેઠિયા, રૂપારેલ, **ડેપા**રેલ રૂપારેલ વગેરેએ હવનમાં આહૂતિ આપી હતી.

મોટા અંગીયામાં ધણીબાવાનો વાર્ષિક

પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

તે પાંચ પરાડાતા ગાઇ જાાઇ લે કથાશ્રવણનો લાભ ૨ સર્વેનો આભાર વ્યક્ત હતો. ભાગવત કથા માટે આશીર્વાદરૂપ થાય રૂપારેલે લેનાર કર્યો તેવી મનોકામના વ્યક્ત કરીને કાર પંકજભાઈ વ્યાસનો આભાર માન્યો હતો. આયોજક

આયોજક



સર્વે પિત્રઓના મોક્ષાર્થે શૈલીમાં કથામાં આવતા પ્રસંગોનું વર્શન કર્યું હતું. કથા વિરામ બાદ રવિવારે પ્રાર્થના કરી હતી પ્રાયના કરા હતા. હવનની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બહોળી સંખ્યામાં ભાષિકોએ મહાપ્રસાદનો લાભ યજ્ઞનું આયોજન નારાયણ વજ્ઞનુ આવાજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ અનુસાર હવન કાર્યમાં યજમાન પરિવારન સભ્યોએ આહૂતિ આપી હતી લીધો હતો. આ पश्चिारना પ્રસંગે

ભુજ : શહેરમાં રૂપારેલ તથા સોમૈયા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહની શનિવારે પુર્ણાહુતી થઇ હતી. ૨૨ જાન્યુઆરીથી શરૂ થયેલ કૃથાનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. વ્યાસપીઠેથી પંકજભાઈ વ્યાસે ભાવવાહી

તોલાણી કલાનિકેતન અને ક્રિએટીવ ફાઈન આર્ટસ એકેડમી દ્વારા રંગપૂરણી સ્પર્ધા યોજાઈ

નારાયશ

આદિપુર : શહેરની તોલાશી કલાનિકેતન અને ક્રિએટીવ ફાઈન આર્ટ્સ એકેડેમી દ્વારા ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના સહયોગથી તોલાણી કોમર્સ કોલેજમાં રાપ્યાજ્ઞા ગગ્યત ગગ્ય ગાય છે. રંગપૂરણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલામાં રસ ધરાવતા વિવિધ_્કોલેજોના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ મનીષા વાલેરા (તોલાની પ્રથમ મનાયા વાલરા (તાલાના) કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ), દ્વિતીય પ્રિયા મોર્યાજ્ઞી (તોલાણી કોમર્સ કોલેજ), તૃતિય કિરસ મુલચંદાની (તોલાની મોટવાણી ઇન્સ્ટિટ્યૂટ કોર મેનેજમેન્ટ સ્ટડીઝ), ગાયત્રી આ બાહ દર્શા દર્શ સાયન્સ), (તોલાણી કોમન ેચ કિરણ ેગ્વા જ્ઞાવ્યા માન્યપક્ષ કા હડવ્યૂટ ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ), ગાયત્રી ઝા, શેખ કશિશ, દ્વર્ગા મનાની, હડિયા શ્વેતાને પ્રશંસા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. યુરાકાર ગાયમાના ગામ્યા હતા. ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના એડમિનિસ્ટ્રેશન હેડ વેંકટેશ અને તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય મનીષ પંડચા દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતા. ગમામાં આપપામાં આપ્યાં હતા. કાર્યક્રમના અંતે ક્રિએટિવ ફાઇન આર્ટસ એકેડમીના ડાયરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર બુજજીબાબુ ડોંગા (બાબુ સર)એ કલાક્ષેત્રે કૉરકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તોલાણી કલાનિકેતન દ્વારા શરૂ થવા જઈ રહેલા ફાઉન્ડેશન કોર્સે



સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતી નિમિતે જિલ્લા કોંગ્રેસની વંદના રાપરના ધારાસભ્યએ ભરૂડિયા ગામની લીધી મલાકાત દેશની

ભુજ : "સ્વતંત્રત બલીદાન માંગતી હ", "તુમ મુજે ખુન દો મે તુમ્હ આઝાઠી દુગા" જેવા જુસ્સા પ્રેરક અને ક્રાંતિકારી નારા આપનાર અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારતની પ્રજા નખરાખ કાગ્રસા દિવગતાના અમુલ્ય ફાળો હતો, જ્યારે આજે નેતાજીના મુલ્યો તથા રાષ્ટ્રભાવના સાથે કેન્દ્ર સરકાર ખીલવાડ કરી રહી છે, જે દુ:ખદ છે. નેતાજી જેવાદિવંગત નેતાએ કોંગ્રેસના્ર્રાષ્ટ્રીય્ બને માં ભારતીને છોડાવનાર બબિલ ભારતી રાષ્ટ્રીય આબલ ભારતા રાષ્ટ્રાય કોંગ્રેસના યુવા પ્રમુખ અને આઝાદ હિન્દ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતી નિમિતે કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન્ન, રુ.અટ છે. નતાજી ઠવા દવગત નેતાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદે રહી અંગ્રેજો સાથે આવિરત સંઘર્ષ કર્યો જે ખુબ જ ગૌરવપ્રદ બાબત છે અને પ્રત્યેક કોંગ્રેસી માટે ગોરવ સમાન છે. ઉપરાંત દેશ માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર સુભાષચંદ્ર ભુજ મધ્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના આદેશથી યોજાનારા કાર્યક્રમમાં બોઝની જિલ્લા મથક ભુજ મધ્યે પૂર્શ કદની પ્રતિમા નિમાર્શ વંદના કરી શ્રધ્ધાસુમન અર્પણ પૂર્ણ યોય તે અંગે જિલ્લા કોંગ્રેસના

કિશોરદાન ગઢવી વિગેરેએ આઝાદીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા નખશીખ કોંગ્રેસી દિવંગતોનો નિર્ણય લીધો હતો.

હુંભાર, પી.સી. ગઢવી, માનસી શાહ, વેરશી મહેશ્વરી, મુસ્તાક હિંગોરજા, અંજલી ગોર,

ાડશારદાન ગઢવા વિગરઝ સૂચન કરી ઠરાવ પસાર કરી અને આ બાબતે સબંધિત તંત્રને વિધિવત દરખાસ્ત કરવાનો ા ક્ષેધ્ધાસુમન અર્પણ કરી વેળાએ અરજણભાઈ ભુડીયા, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ

એવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભાર દારા જણાવાયું હતુ.

હિંગોરજા, અંજલી ગોર, ધીરજ રૂપાણી, રઝાકભાઈ ચાકી, જયંતીભાઈ પારેખ, કપીલભાઇઈ ગોર, આદમભાઈ કુંભાર, દિગ્વીજયસિંહ જાડેજા વગેરે આગેવાનોએ વંદના કરી શ્રધ્ધાસુમન અર્પશ કર્યા હતા

નાખ્યાણા : તાલુકાના મોટા અંગીયા ગામે મુંછરિયા પરિવારના ઇપ્ટેલ પછીબાવાનો વાર્થિક પાટેસવા આમ્યુમથી ઉજવાયો હતો. મંદિરના પુજરી કલાવાજી ગરવાના સાનિષ્યમાં સવારે મંદિરે 'વજારોહણ, આરતી સાંજે પુખ્ડીપ-મહાપ્રસાદ લોજાયા હતા. રાત્રે વિનયકાંત ગોર, હરી ભારોટ, બાળેદ ભારોટની સંતવાથી પોજાઇ હતી. આ પ્રસંગે ડો. રમેશભાઇ ગરવા , રાર્વભાઈ નામોરી, ઘનશ્યામભાઈ ગરવા, સરપંચ ઈઠબાલ ભાઈ ચાંચી, નાગલયર સરપંચ રમેશ સાંજુ, અપ્રશી દાતા તે લજીભાઈ વરારિયા, બુધ્ધીહાલભાઈ, હીરાહાલભાઈ (દેવીસર), મજી માંઝુ, નવિનભાઈ અમૃત ભાલા, તુલસીભાઈ ગરવા, તે લજીભાઈ, અગ્રુથણે દાતા ને લજીભાઈ ગરવા, સંચ કું કું આ પાર્ક સ્થાનંકમાં લિક્સ માટે આ પ્ર. અને દાતાઓ કટીબધ્ધ છે. બાનની કોમીએકના ટકાવી રાખવા અનુરોપ કર્યો હતો. મંદિરને રોશનીથી શલગારવામાં આવ્યો હતો. કાર્યક્રમને સકળ બનાવવા હરેશભાઈ બાધુભાઈ, સ્યેશભાઈ બાહેતા સેવકોએ અથાગ જહેમત ઉઠાવી હતી. નપગાશા, લુજ, માંડવી, ગાંધીપા સહિત વેસ્તારેઓ આપ જહેમત ઉઠાવી હતી. નપગાશા, લુજ, માંડવી, ભાઈ પાસ સહિત વેસ્તારમાંથી દાદાના સંવર્ક ઇપસ્થિત રહ્યા હતા. સંચાલન રમેશભાઈ બી. ગરવા (તા.પં. નપત્રાણ) કર્યુ હતું. આભારવિધિ હાલુબાઈ ગરવા કરી હતી. હિમાયત કરીને શક્ય એટલા તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. તમાં મંપ્રવેલા હાય થયો હતા. સ્વ. દામજીભાઈની વિદાયથી કચ્છને કયારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે. આ દુઃખની ઘડીએ સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવારની સંવેદનાઓ દામજીભાઈના પરિવારની સાથે



અન્ય રોગચાળાઓ સમયે માંગો ત્યાં મેડીકલ કેમ્પ માટે એમશે ઉદાર હાથે દાન આપ્યું છે. જયારે કોરોના કાળમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર સાથે મસ્કા હોસ્પિટલે માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. કોરોના સમયે અંદાજીત એક લાખ માસ્ક વિતુરણ, ૧૨ હજારથી વધુ દર્દીઓની વિનામૂલ્યે સારવાર અને ૧૦ હજાર જેટલી ઓકિસજન્ની બોટલ સેવા પુરી પાડવામાં તેઆ સતત મદદરૂપ



ભચાઉ રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા બાદ પ્રથમ વખત તાલકાના ભરૂડિયા ગામે એકલ માતાજીના દર્શન કર્યા હતા. બાદ ગામના ત્યાર આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. . એકલધામના મહંત દેવનાથ બાપુ, રાપર

તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા. ભચાઉ નગેરપાલીકાના રાજકીય, સામાજિક ગ્રામજનો વાનો

કરાયા હતાં.

આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન



બન્યાં હતા EXTRACT OF STATEMENT OF UNA NCIAL RESULTS Quarter Ended Particulars 31.12.2022 31.12.2021 Unaudited) Total Income Profit before Tax Net Profit for the period Total Comprehensive Income/(loss) for the period (Comprehensive Income (after tax)) and Other Comprehensive Income (after tax) Comprehensive Income (after tax) Capital (Shares or Re, 1 each) Other Equily as shown in the Audited Balance Sheet as on March 31,2022 Security Premium Accounts as shown in the Audited Balance Sheet as on March 31,2022 Net Worth Paid up Dath Capital Outstanding Debt Outstanding Redeemable Preference Shares Debt Equity Ratio (in times) 1,904.1 78.5 43.83 131.0 63.64 98.8 143.02 98.81 3,735.75 3,864.97 Debt Equity Ratio (in times) Earnings Per Share (of Re. 1 each) (Not annualised for q 0.7 0.81 0.43 0.43 1.34 1.34 b) Diluted b) Diulted Capital Redemption Reserve as shown in the Audited Balance Sheet as on March 31,2022 Debenture Redemption Reserve as shown in the Audited Balance Sheet as on March 31,2022 Debt Sorvice Coverage Ratio (in times) Interest Service Coverage Ratio (in times) The above is an extract of detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation of 33 of the SEBI (Lusting Obligations and Other Disclosure Requirements) Regulation 2015, The Iuli format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites and www.bseindia.com and also on company's website www.webspunindia.com, Additional Information on standation financial results is a solitow: (< in Crores) and v

Particulars 31.12.2022 31.12.2021 (Unaudited) (Unaudited) 31.03.2022 (Audited) Total Income Profit before Tax Net Profit for the pe Total Comprehensi 1,419,94 6.789.5 79.18 619.3 392.1 395.2 Mumbai Date : January 30, 2023 EO and Jt. MD DIN: 00007199

પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય નામેરીભાઈ પંચાયત સદસ્ય નાન્ન્સ્સ્સ આહીર, જમીન વિકાસ બેંકના ેન્ગેન હમીરભાઇ આહીર સહિત ઉપસ્થિત રહ્યા હતા અબડાસા-લખપત તાલુકાનો અટલ ભુજલ યોજના હેઠળ સમાવેશ જરૂરી

બાબત છે

નખત્રાણા ઃ અટલ ભુજલ યોજના તળે ટપક સિંચાઈ માટે મળતી વધારાની સહાયમાં અબરામા અને લખપત તાલુકાના ગામોનો સમાવેશ હાંચુકા બંધા થાયા ધારાસભ્ય દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સૌથી ઓછો અને નહિવત વરસાદ ધરાવતો કચ્છનો સીમાવર્તી વિસ્તાર અબડાસા અને લખપત તાલુકાનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. પાતાળમાં પાણી ઉંડા અને



યોજના હેઠળ જુદા-જુદા વિસ્તારમાં રિચાર્જ ટ્યુબવેલ અને તળાવો બનાવવાની અન તળાવા બનાવવાના કામગીરી તથા પાણીનો કાર્યક્ષમ અને કરક્સરયુક્ત વપરાશ થાય તે હેતુથી ખેડૂતોને સિંચાઈ પદ્ધતિમાં વધારાની સહાય અને સબસીડી અપતા પાર વુક્તા હાવાવા જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. આવા પાશી વડે ખેતી આપવામાં આવે છે. આ યોજનામાં

રહા છે. આવા પાજ્ય પડ આપ કરવી મુશ્કેલ છે અને લોકો આ વિસ્તારમાંથી પલાયન કરી રહ્યા છે. સરહદી વિસ્તારના ગામડા પડી ભાંગે તો દેશની સરહદી સુરક્ષા માટે ચિંતાજનક આ યાજનામાં કચ્છના અન્ય તાલુકા સમવાયા છે, પરંતુ જયા સૌથી વધુ જરૂર છે તે અબડાસા અને લખપત તાલુકાઓનો તેમાં સમાવેશ નહીં હોવાથી ધારાસભ્યએ તાલુકાઓને યોજનાનો લાભ આપવા અનુરોધ કર્યો છે. બાબત છ. બીજી બાજુ ભૂગર્ભ જળની સપાટી જળવાઈ રહે તે માટે

ગઢવીએ જણાવ્યું હતું કે,